



## નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ



પરિપત્ર નં. ૬૪ તા. ૨૪-૦૯-૨૦૨૦

ફક્ત ભૂનિ. શાળાઓ માટે જ :-

વિષય:- તમામ શાળાઓમાં Microsoft Teams મારફતે વર્ચ્યુલ ક્લાસ દ્વારા શિક્ષણ આપવા બાબત.

સંદર્ભ:- ક્રમાંક -SSA/MIS/૨૦૨૦/૩૨૮૮૦-૯૬૧ તા. ૨૩-૦૯-૨૦૨૦


આથી તમામ ભૂનિ. શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓને ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, દરેક શિક્ષકો પોતાની પાસેના મોબાઇલ, ટેબલેટ, લેપટોપ વગેરે ઉપકરણોનો ઉપયોગ કરીને Microsoft Teams દ્વારા ફરજિયાત વર્ચ્યુલ ક્લાસ યોજે તેમ જણાવવામાં આવે છે.

Microsoft Teams દ્વારા આ૽નલાઈન વર્ગો કરવા માટેની માર્ગદર્શિકા આ પત્ર સાથે સામેલ છે. જેનો ચુસ્ત અમલ કરીને વિદ્યાર્થીઓને વર્ચ્યુલ ક્લાસ દ્વારા શિક્ષણ આપવા જણાવવામાં આવે છે.

બિડાણ :- સંદર્ભિત પત્ર

તા. ૨૪-૦૯-૨૦૨૦

ડૉ. એલ. ડી. દેસાઈ  
શાસનાધિકારી



શિક્ષણનો અધિકાર

સર્વ શિક્ષા અભિયાન  
સૌ ભાષા, સૌ આગળ વધો

## ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ

### સમગ્ર શિક્ષા

સેક્ટર નં. ૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭, ગુજરાત રાજ્ય

ફોન નં.: ૦૭૯-૪૩૧૩૩

ફેક્સ: - ૦૭૯-૨૬૨૬૪૩૬

ટોલફોન નંબર: ૧૮૦૦-૨૩૩-૭૮૬૫

ક્રમાંક: SSA/MIS/2020 | ૩૨૮૮૦ -૯૯૨

તા.૩૩/૮ /૨૦૨૦

પ્રતિ,

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી  
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી  
જિલ્લા: તમામ

જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર અને  
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી  
જિલ્લા પ્રોજેક્ટ કચેરી, એસએસએ,  
જિલ્લા: તમામ

એડી. જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર અને  
શાસનાધિકારીશ્રી  
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ  
જિ. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ

### વિષય: તમામ શાળાઓમાં Microsoft Teams માફરત વર્ચ્યુલ કલાસ દ્વારા શિક્ષણ આપવા બાબત

આપ સુવિદિત છો કે, હાલ Covid-19ના સમયમાં શાળાઓમાં બાળકોનું શિક્ષણ અનિયમિત બન્યું છે. આપના જિલ્લાના શિક્ષકો શાળાએ જઇને તેમજ પોતાની રીતે ડીવાઇસ સાથે/વગરના તમામ બાળકોનું હોમ લર્નિંગ કરાવી રહ્યા છે. સુચના મુજબ ડેઇલી વાલીઓને ફોન કરીને હોમ લર્નિંગ વિષે સારી રીતે માહિતગાર પણ કરી રહ્યા છે. ઉપરાંત ધો. ૮-૧૦ અને ધો. ૧૧-૧૨ માટે “ગુજરાત વર્ચ્યુલ શાળા” અંતર્ગત યુટ્યુબ, ફેસબુક, માઇક્રોસ્ફેર ટીમ્સ અને જીયો ટીવી મારફત લાઇવ વેબકાસ્ટ પણ થઇ રહ્યું છે. તેની લીક વગેરે પણ તમામ વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં શિક્ષકો મદદરૂપ થઇ રહ્યા છે. આ ઉપરાંત સમગ્ર શિક્ષા દ્વારા વિદ્યાર્થીઓ પાસે હોમ લર્નિંગ અંતર્ગત ડિવાઇસ છે કે કેમ? તે જાણવા માટે એક સર્વે હાથ ધરેલ હતો અને આ સર્વેમાં એવું જાણવા મળેલ છે કે રાજ્યમાં મહદદંશો ૪૦% વિદ્યાર્થીઓ ડિજિટલ ડિવાઇસીસનો ઉપયોગ કરી રહ્યા છે.

રાજ્ય સરકાર શિક્ષણ વિભાગનો અભિગમ કોવિડની મહામારી દરમયાન એક પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે અનેક પહેલો અને પ્રયત્નો કરેલ છે. જેના ભાગરૂપે Microsoft Teams નો ઉપયોગ કરીને શાળાના શિક્ષકો પોતાના બાળકોને વર્ચ્યુલ્ય ભાષાવે તે હેતુથી Microsoft દ્વારા રાજ્યના તમામ ધો. ૩ થી ૧૨ના સરકારી અને ગ્રાન્ટ શાળામાં ભણતા તમામ બાળકો અને શિક્ષકો માટે યુઝર એકાઉન્ટ બનાવેલ છે.

અત્રેથી એવું જોવા મળેલ છે કે હાલ માત્ર અમુક જ શિક્ષકો Microsoft Teamsનો ઉપયોગ કરી બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. અત્રેથી આપની પાસેથી એ અપેક્ષા છે કે શાળામાં ઉપલબ્ધ IA સામગ્રીનો પુરતો ઉપયોગ કરીને અને જરૂર જણાયે શિક્ષકો પોતાની પાસેના મોબાઇલ, ટેબ્લેટ, લેપટોપ વગેરે ઉપકરણનો ઉપયોગ કરીને Microsoft Teams દ્વારા ફરજિયાત વર્ચ્યુલ કલાસ યોજે. આપ પણ જિલ્લા કક્ષાએથી અમુક વર્ગમાં જોડાવ તેવી અપેક્ષા છે.

તમામ શાળાઓએ નીચે મુજબના વર્ગો માટે સામાંહિક સમયપત્રક નિભાવવું પડશે.

ધોરણ	ધોરણ 3 અને 4	ધોરણ 5	ધોરણ 6,7,8	ધોરણ 9 અને 10	ધોરણ 11 અને 12
સમય	1 કલાક 2 વિષયના 2 તાસ (દરેક 30 મિનિટ)	1 કલાક 2 વિષયના 2 તાસ (દરેક 30 મિનિટ)	1.5 કલાક 2 વિષયના 2 તાસ (દરેક 30 મિનિટ) 30 મિનિટ શંકાને ઉકેલવાનું તાસ	2 કલાક 2 વિષયના 2 તાસ (દરેક 45 મિનિટ) 30 મિનિટ શંકાને ઉકેલવાનું તાસ	2 કલાક 2 વિષયના 2 તાસ (દરેક 45 મિનિટ) 30 મિનિટ શંકાને ઉકેલવાનું તાસ
વિષય	ગુજરાતી ગણિત પર્યાવરણ	ગુજરાતી ગણિત પર્યાવરણ અંગ્રેજી હિન્દી	ગુજરાતી ગણિત વિજ્ઞાન સા.વિ. અંગ્રેજી હિન્દી સંસ્કૃત	ગુજરાતી ગણિત વિજ્ઞાન સા.વિ. અંગ્રેજી હિન્દી સંસ્કૃત	ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન ગણિત આંકડાશાસ્ત્ર નામાનાં મૂળતત્ત્વો અંગ્રેજી

ઉપરોક્ત સમયપત્રક મુજબ પાઠ આયોજન/પ્રોજેક્ટને તૈયાર કરવામાં આપના જિલ્લાના શિક્ષકો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની મદદ લઈ શકે/ઉપયોગ પણ કરી શકે તેવું આયોજન કરવા વિનંતી.

ઉપરોક્ત સમયપત્રક મુજબ શાળાએ વાલીઓના અને બાળકોના અનુરૂપ સમયે કલાસ લેવાના રહેશે. આ કલાસમાં ડિડી ગિરનાર અને ગુજરાત વર્ચ્યુલ શાળા દ્વારા શીખવવામાં આવતા વિષયોમાં બાળકોને કોઇ પ્રક્રિયા ઉપસ્થિત થયા હોય તો તેનું પણ નિરાકરણ શિક્ષકો આપી શકે છે. આ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરી શકે છે. Quiz, Prayer, Extra Activity પણ કરાવી શકો છી.

માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા શિક્ષકો દ્વારા લેવાતા વર્ગોનું નિરીક્ષણ આપની કક્ષાએથી કરવું અને આ ઉપરાંત સામાંહિક પ્રોગ્રામ્સ પણ અત્રે મોકલી આપવો.

માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા ઓનલાઇન વર્ગો કરવા માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.

  
નિયામક  
જુસીએચાર્ટી  
ગાંધીનગર

  
નિયામક

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી  
ગાંધીનગર

  
નિયામક  
શાળાઓની કચેરી  
ગાંધીનગર

  
P. M.  
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર  
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ  
સમગ્ર શિક્ષણ, ગાંધીનગર

#### નકલ સંવિનય રવાના જાણ સારું:

- માન. સચિવશ્રી (પ્રા. અને મા. શિક્ષણ), શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

માઇકોસોફ્ટ ટીમ્સ દ્વારા ઓનલાઈન વર્ગો કરવા માટેની માર્ગદર્શિકા નીચે આપેલ છે.

1. આચાર્ય / મુખ્ય શિક્ષકે અઠવાડિયામાં બધા વિષયો આવરી લેવાય તે બાબત સુનિશ્ચિત કરવા માટે શાળાના શિક્ષકો સાથે પરામર્શ કરીને સામાહિક સમયપત્રક તૈયાર કરવાનું રહેશે.
2. વાલી અને વિદ્યાર્થીઓને સમયપત્રક પહોંચતું કરો અને રોજિદા વર્ગની અગાઉથી જાણકારી આપો. (વર્ગના એક દિવસ પહેલા)
3. શાળાના દરેક શિક્ષકે માઇકોસોફ્ટ ટીમ્સ દ્વારા ઓનલાઈન શિક્ષણનો એક તાસ લેવો આવશ્યક છે.
4. શરૂઆતમાં શિક્ષકો માઇકોસોફ્ટ ટીમ્સ દ્વારા વર્ગ ચલાવવા માટે આચાર્ય / સીઆરસી / બ્લોક એમઆઈએસ પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
5. વર્ગમાં ભાગ લેવા માટે માઇકોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરવા માટે શિક્ષકોએ જરૂર જણાય તો બાળકો / વાલીઓને જરૂરી માર્ગદર્શન આપવું અથવા હેન્ડહોલ્ડિંગ કરવું.
6. વર્ગની સંખ્યા ખૂબ ઓછી હોય ત્યારે તબક્કકાવાર આયોજન કરો અને વર્ગના તમામ બાળકો સામેલ થાય તે રીતે વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડાવા માટે પ્રોત્સાહિત કરો.
7. ડી.ડી. ગિરનાર અથવા ગુજરાત વર્ષ્યુઅલ શાળા વર્ગના સંબંધિત ધોરણ / વિષયો માટેના ટેલિકાસ્ટ સમય દરમ્યાન આ વર્ગનું આયોજન કરવું નહીં.
8. મહત્તમ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તે માટે તેમના સમયની અનુકૂળતાને પ્રાધાન્ય આપો.
9. વર્ગ દરમિયાન કોઈ બાધ્ય disturbance હોવું જોઈએ નહીં.
10. પ્રારંભિક વર્ગો (ધોરણ 3 થી 8) માટે એક તાસનો સમયગાળો 30- 35 મિનિટનો રાખવો અને માધ્યમિક વર્ગ (ધો. 9 થી 12) માટે 40- 45 મિનિટ રાખવો.
11. સતત બે તાસ વચ્ચે 10-15 મિનિટનો વિરામ આપો.
12. વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસમાં રસપ્રદ કરીને બારીકાઈથી ચર્ચા કરવા પ્રોત્સાહિત કરવા.
13. ઇન્ટરનેટનો ઉપયોગ સાવધાની સાથે કષેત્ર રીતે કરવો તેની ચર્ચા નિયમિત વિદ્યાર્થીઓ સાથે તેઓને શૈક્ષણિક પ્રવૃત્તિ તરફ વાળવા.
14. તાલ્કાલિક અને સતત પ્રતિસાદ માટે પ્રામ ટીપ્પણીઓના આધારે તાસમાં સુધારા કરવા.
15. 2-3 થીમ્સ પૂર્ણ કર્યા પછી ગૃહકાર્યો/મહાવરો આપવો અને અભ્યાસક્રમો સાથે સંબંધિત આવેલ કોમેન્ટને પ્રવૃત્તિઓના સ્વરૂપમાં લો અને ચર્ચા દરમિયાન તેની સમીક્ષા કરો.
16. મહાવરો વ્યક્તિગત અથવા જીથ પ્રવૃત્તિઓના સ્વરૂપમાં હોઈ શકે છે.
17. શિક્ષકો ટ્રેકિંગ અને નિરીક્ષણ માટેના પોતાના માપદંડ નક્કી કરી શકે છે.
18. માઇકોસોફ્ટ ટીમ્સ દ્વારા વર્ગ લેતા પહેલા આયોજન તૈયાર કરો.
19. પાઠ આયોજનની તૈયારી માટે DIKSHA પોર્ટલ, અભ્યાસક્રમ અને અન્ય ઓનલાઈન રીસોર્સ્સનો ઉપયોગ કરો.
20. વિદ્યાર્થીઓના હાજરીની સાથે જેટલા પાઠ પૂર્ણ થઇ ગયા હોય તેનો રેકોર્ડ રાખવો.
21. સમગ્ર શિક્ષા, જીસીઇઆરટી અને માધ્યમિક શિક્ષણ બોર્ડ અને અન્ય ઓનલાઈન સોટો દ્વારા બનાવેલ વિવિધ પ્રકારની સંદર્ભ અભ્યાસ સામગ્રીનો ઉપયોગ કરવો.
22. ઓનલાઈન ક્લાસ દરમ્યાન શિક્ષકે બનાવેલ નીચેના ફોર્મેટમાં પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓને આપવા પ્રયત્ન કરવાનો રહેશે.
  - a. સ્વાઇફ્સ સરળતાથી વાંચવા યોગ્ય હોવી જોઈએ.
  - b. દરેક પૃષ્ઠ પર 5 બુલેટ પોઇન્ટ / મુદ્દાઓ હોવા જોઈએ.
  - c. પિકચર/ફોટો, ગ્રાફ, ચાર્ટ્સનો મહત્તમ ઉપયોગ.
  - d. શક્ય હોય તો કોષ્ટકો ટાળો.
  - e. ફોન્ટની સાઇઝ - ન્યૂનતમ 24 પોઇન્ટ રાખવી